ISHAN DYES & CHEMICALS LTD.



15th November, 2024

To The Department of Corporate Services **BSE Limited** Phiroze Jeejeebhoy Tower Dalal Street, Mumbai - 400001

Ref: ISHAN DYES AND CHEMICALS LIMITED BSE SCRIP CODE: 531109 SYMBOL: ISHANCH

SUB: NEWSPAPER PUBLICATION FOR THE UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER 2024.

Dear Sir,

Pursuant to Regulation 30 and Regulation 47 of SEBI (Listing Obligations and DisclosureRequirements) Regulations, 2015, we are enclosing herewiththe copies of NewspaperPublications published in the Financial Express (English) and Lok Mitra(Gujarati) on 15th November, 2024for the Un-Audited Standalone Financial Results of theCompany for the Quarter and Half yearended 30thSeptember 2024.

You are requested to take the same on records.

Thanking you,

Yours faithfully,

For and on behalf of ISHAN DYES AND CHEMICALS LIMITED

Shrinal P Patel **Whole-Time Director** DIN - 02992519

Encl: As above



Registered Office and Factory Address:

18, G.I.D.C. Estate, Phase-I, Vatva, Ahmedabad - 382 445, Gujarat, India

Phone : +91-79-25832144, 25893607 Fax :+91-79-25833643 E-mail: ishandyes@yahoo.com; ishan@ishandyes.com

Web : www.ishandyes.com CIN

: L24110GJ1993PLC020737





Certificate Number 7086 ISO 9001, ISO 14001

RAJKOT INVESTMENT TRUST LIMITED

CIN: L65910GJ1982PLC005301

Regd. Office: 526 Star Chambers Harihar Chowk, Rajkot, Gujarat 360001 Corporate Office: Super Tex Tower Opposite Kinney Talkies, Ring Road, Surat-395002 IN E-mail id: raikotitltd@gmail.com | Website: www.ritl.co.in | M. No.: +91-8128172521

					(₹ In Lai	khs except pe	er share data)
		3	Quarter End	ed	Half Yea	Year Ended	
SI No.	Particulars	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024
eu.		(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1.	Total income from operations (net)	22.74	22.54	0.10	45.28	2.74	43.77
2.	Net Profit / (Loss) for the period (before Tax,	1866.00		985650	1990/200		6 3 3 5 5
20	Exceptional and/or Extraordinary items)	12.97	7.33	(10.02)	20.30	(12.86)	9.87
3.	Net Profit / (Loss) for the period before tax	- varane	manage	279 km 2000 C	175.007000077	100000000	2000
	(after Exceptional &/or Extraordinary items)	12.97	7.33	(10.02)	20.30	(12.86)	9.87
4.	Net Profit / (Loss) for the period after tax	127025	1000	705022	8228200	7,5200	18103
211	(after Exceptional &/or Extraordinary items)	12.97	7.33	(10.02)	20.30	(12.86)	5.50
5.	Total Comprehensive Income for the period						
	[Comprising Profit / (Loss) for the period						
	(after tax) and Other Comprehensive Income (after tax)]	12.97	7.33	(10.02)	20.30	(12.86)	5.50
6.	Equity Share Capital	100.00	100.00	100.00	100.00	100.00	100.00
7.	Other Equity excluding Revaluation Reserve	100.00	100.00	100.00	379.13	339.45	357.81
8.					3/9.13	333.40	337.01
0.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)						
	Basic	1.30	0.73	(1.00)	2.03	(1.29)	0.55
	Diluted:	1.30	0.73	(1.00)	2.03	(1.29)	0.55

Note: The above is an extract of the detailed format of Un-Audited Financial Results for the Quarter and Half Year ended on September 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the the website of the Company i.e. www.ritl.co.in and on the website of BSE Ltd (www.bseindia.com)

For, RAJKOT INVESTMENT TRUST LIMITED

Date: 14.11.2024 Place: Surat

SHRIKRISHNA BABURAM PANDEY MANAGING DIRECTOR (DIN: 07035767)



redeem the secured assets.

SAURASHTRA GRAMIN BANK

Regional Office, R-V, Rajkot: 2nd Floor, Viral Heights, Near Time Square - 2, Ayodhya Chowk, 150 Feet Ring Road, Rajkot - 360005. Phone: 0281-2966050.

Publication of Notice regarding Possession of Property u/s 13(4) of SARFAESI Act 2002

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of power conferred on him/her under section

13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account. The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the

property will be subject to the charge of the SAURASHTRA GRAMIN BANK for an amount and interest thereon. The borrowers attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available to

Branch	Name of Account/	Name of Proprietor/ Partners/	Description Of The	Date of	Date of Possession	Amount
	Borrower & Address	Guarantors/ Owner of Property etc.	Property Mortgaged/ Charged	Demand Notice	Type of Possession	Outstanding
Dhebar	Mr.	Mr.	A Residential House situated on the	06.08.2024	08.11.2024	Rs.
Road	Mayurbhai Shankarlal Trivedi	Upendrabhai Trivedi (Guarantor)	Land Admeasuring 55.78 Sq. Mtr., si.e 66.71 Sq. Yards of Sub Plot No. A-7 of Plot No. 11 to 15 paiki of "Ashopalav Residency" situated in Village Hadala, Rev. Survey No. 169 known as Jivandhara Residency Plots, Talluka & District Rajkot		Symbolic	1,77,533 +Interest from 06.08.2024

Date: 15.11.2024, Place: Rajkot

Authorized Officer, Saurashtra Gramin Bank

Encore Asset Reconstruction Company Private Limited (Encore ARC) earc Encore ARC Corporate Office Address: 5th Floor, Plot No. 137, Sector 44, Gurugram 122002, Haryana

PUBLIC NOTICE FOR E-AUCTION e-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("SARFAESI Act") read with proviso to Rule 8 (6) of Security Interest (Enforcement) Rules, 2002 ("Rules")

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable properties mortgaged/charged to Manappuram Home Finance Ltd. to secure the outstanding dues in the loan accounts since assigned to Encore ARC (Secured Creditor) acting in its capacity as the Trustee of EARC-Bank-029-Trust, the possession of which has been taken by the Authorised Officer of Manappuram Home Finance Limited, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis on through e-auction on 05-12-2024 at 11:00 AM, for recovery of outstanding dues of Rs. 20,14,886/- (Rupees Twenty Lakhs Fourteen Thousand Eight Hundred and Eighty-Six Only) as on 31-10-2024 together with further interest from 01-11-2024 at contractual rate till recovery and other expenses, costs, charges etc due to the Encore ARC (Secured Creditor), from Borrowers, Co-Borrowers and Guarantor viz. BHUPATKUMAR VALABHAI DAV (Borrower), SHARDABEN BHUPATBHAI DAV (Co-Borrower) and RASIKLAL THUMAR (Guarantor).

of mortgaged property/les by exercising general lien / set off. The description of the mortgaged immovable property, the details of Reserve Price for the Secured Assets, the

Encore ARC reserves right to adjust / set off the surplus if any to the above noted account out of the sale proceeds

Earnest Money Deposit, and Minimum Increment Amount in Bidding Process are as under:

Item Sr No.	Name of Account	Descripti	on of Property	Reserve Price (In Rs.)	Earnest Money Deposit (In Rs.)	Minimum Increment Amount in Bidding			
1.	BHUPATKUMAR VALABHAI DAV	No. 401, admeas mtrs. Super Bu mtrs. Built up sit of Building No. Residency contr Revenue Survey No. 550/A of Villa Kamrej, District	e and interest in Flat suring about 85.14 sq. silt up and 55.06 sq. uated on the 4th Floor C-14 of Man Sarovar ucted on land bearing v No. 683 and its Block age Kathor, Sub District Surat -394150. East -assage. North-Flat No. No. 402.	(Rupees Seven Lakhs Fifty Thousand Only)	75,000/- (Rupees Seventy- Five Thousand Only)	Process (In Rs.) 1000/- (Rupees Thousand Only)			
Date	of Inspection of	Secured Assets	28-11-2024 between 10:00 AM to 3:00 PM						
Last	Date of Submiss	ion of online Bid	Before 3.00 PM on 04-12-2024						
Date	& Time of e-Auc	tion	05-12-2024 at 11.00 AM to 1:00 PM with unlimited extensions						

of 5 minutes each as per Terms & Conditions mentioned below. Auction Website: https://bankeauctions.com in case the e-Auction date is declared public holiday then the date will be automatically extended to the very next

Since Encore ARC is acting in its capacity as Trustee of EARC-Bank-029-Trust only, any reference of its name in

this Public Notice should be construed accordingly. For detailed terms and conditions of the sale, please refer to the link provided in Encore ARC's website i.e.

https://www.encorearc.com.and.https://bankeauctions.com. Interested bidders may contact Authorised Officer Mr. K. Lokesh Kumar on 9789912168, Mr. Sabari Sundar on

7904918124, Mr. Sagar Prakash Pawar on Mobile 9072602882 for any further information / query.

K. Lokesh Kumar Date: 15-11-2024 **Authorised Officer** Place : Surat Encore Asset Reconstruction Company Pvt Ltd



IMP POWERS LIMITED

Regd. Office: Survey No. 263/3/2/2, Sayli Village, Umar Kuin Road, Silvassa 396 230, Dadra Nagar Haveli (U. T)

CIN: L31300DN1961PLC000232 Extract of statement of Unaudited Financial results for the Quarter & Half year ended September 30,2024

		Standalone									Consolidate	ed	
Sr.	122 57022 572 57377	Quarter Ended		Half Year Ended		Year Ended	C	Quarter Ended		Half Year Ended		Year Ended	
No.	Particulare	30-Sep-2024 Unaudited	30-Jun-2024 Unaudited	25 7 CHARLES AND STREET	30-Sep-2024 Unaudited	TYDEON STATISTICS (************************************	31-Mar-2024 Audited	30-Sep-2024 Unaudited	The state of the s	30-Sep-2023 Unaudited	30-Sep-2024 Unaudited	30-Sep-2023 Unaudited	31-Mar-2024 Audited
1	Total Income from Operation	48.84	527.19	98.99	576.03	172.09	229.31	48.84	527.19	98.99	576.03	172.09	229.31
2	Net Profit/(Loss) for the period (before Exceptional items)	(325.40)	11.28	(378.65)	(314.12)	(867.60)	(2,048.99)	(326.01)	10.65	(379.66)	(315.36)	(868.84)	(2,051.48)
3	Net Profit/(Loss) for the period before tax	(325.40)	11.28	(378.65)	(314.12)	(867.60)	(2,048.99)	(326.01)	10.65	(379.66)	(315.36)	(868.84)	(2,051.48)
4	Net Profit/(Loss) for the period after tax	(325.40)	11.28	(378.65)	(314.12)	(867.60)	(2,048.99)	(326.01)	10.65	(379.66)	(315.36)	(868.84)	(2,051.48)
5	Total Comprehensive Income for the period/ to attributable of share Holders	(317.64)	19.05	(378.56)	(298.59)	(867.41)	(2,017.93)	(318.11)	18.56	(379.33)	(299.55)	(868.37)	(2,019.86)
6	Paid-up equity share capital (Face Value of Rs. 10 per share)	863.66	863.66	863.66	863,66	863.66	863.66	863.66	863.66	863.66	863.66	863.66	863.66
7	Reserves excluding Revaluation Reserves as per balance sheet date						(27,649.42)						(27,530.12)
8	Earning Per Share (before Extraordinary Item) (of ₹ 10/- each) Basic Rs.	(3.77)	0.13	(4.38)	(3.64)	(10.05)	(23.72)	(3.77)	0.12	(4.39)	(3.65)	(10.06)	(23.75)
	Diluted Rs.	(3.77)	0.13	(4.38)	(3.64)	(10.05)	(23.72)	(3.77)	0.12	(4.39)	(3.65)	(10.06)	
9	Earning Per Share (after Extraordinary Item) (of ₹ 10/- each)	86787-1600	1.004968	200000000	26,1636	i coeranee	V. (0.00.00)	3.000,0000	5200046	Orom-Susk	17 (Sept.//Sept.	0.000.000	30-5,000,000,000

Diluted Rs. Notes:

Basic Rs.

Place: Mumbai

stock exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.imp-powers.com.

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Result is available on the For IMP POWERS LIMITED

Resolution Professional

(10.06)

(23.75)

Mukesh Verma

Date: 14th November 2024

SIGMA SOLVE LIMITED

(10.05)

(CIN:-L72200GJ2010PLC060478)

Registered Office: 801-803, PV Enclave, ICICI Bank Lane Road Sindhubhavan Road, S G Highway, Ahmedabad- 380054 GJ IN

Website: www.sigmasolve.in | E-Mail:- compliance@sigmasolve.net | Contact No.:- +91-792970 8387

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024

	Rs.In lakhs											Rs.In lakhs	
				STAND	ALONE			Į	CONSOLIDATED				
Sr.		Quarter Ended		Half Year Ended Year En		Year Ended	Quarter Ended		ed	Half Year Ended		Year Ended	
No.	Particulars Particulars	30.09.2024	30.09.2023	30.06.2024	30.09.2024	30.09.2023	31.03.2024	30.09.2024	30.09.2023	30.06.2024	30.09.2024	30.09.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	792.66	675.76	833.80	1626.46	1295.60	2866.86	1764.14	1754.25	1674.84	3438.98	3503.02	6859.33
2	Other Income	34.19	21.68	42.55	76.74	48.09	100.80	58.89	123.83	74.62	133.51	243.57	353.88
3	Net Profit/(Loss) from ordinary activities for the period (before tax, Exceptional and/or Extraordinary items)	195.51	78.12	215.86	411.37	196.83	564.83	544.85	662.46	513.66	1058.51	1345.88	2520.91
4	Net Profit/(Loss) from ordinary activities for the period before tax, (After Exceptional and/or Extraordinary items)	195.51	78.12	215.86	411.37	196.83	564.83	544.85	662.46	513.66	1058.51	1345.88	2520.91
5	Net Profit/(Loss) from ordinary activities for the period after tax, (After Exceptional and/or Extraordinary items)	145.40	56.19	163.47	308.87	148.80	421.23	410.85	406.91	392.65	803.50	941.99	1932.52
6	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	144.91	56.81	164.24	309.15	144.38	420.84	418.16	441.94	395.11	813.27	985.28	1961.87
7	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75	1027.75
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.00	0.00	0.00	0.00	0.00	614.15	0.00	0.00	0.00	0.00	0.00	1944.02
9	Earnings Per Share (Face Value of Rs.10/- each)(not annualized) a. Basic b. Diluted	1.41 1.41	0.55 0.55	1.59 1.59	3.01 3.01	1.45 1.45	4.10 4.10	4.00 4.00	2.59 2.59	3.82 3.82	7.82 7.82	6.06 6.06	15.70 15.70

Notes: The above is an extract of the detailed Guarterly and half year Ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full formate of the

Quarterly and Half Year Ended Financial Result are available on the Company's website www.sigmasolve.in and the Stock Excannge website www.bseindia.com and www.nseindia.com

Place: - Ahmedabad Date:- 14.11.2024

Prakash Ratilal Parikh Managing Director (DIN:-03019773)

Sigma Solve Limited



वैक ऑफ़ बड़ीदा Kachhiawadi Branch : Library Building, Kachhiawadi Bank of Baroda Dist. Nevsari. Gujerat- 396427 E-mail: vjkwad@bankofbaroda.co.in

POSSESSION NOTICE

APPENDIX IV [See rule 8(1)] (FOR IMMOVABLE PROPERTY) Whereas, the undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 08/07/2024 calling upon the borrower Mr. Anshu Rajnarayan Das and its Guarantor Mr. Suman kumar Umesh Jha, Mr. Yogeshbhai Thakorbhai Ahir to repay the amount mentioned in the notice being Rs.22,12,325.68/-+ un applied interest from 08/07/2024 + Legal & other expenses within 60 days from the date of receipt of the said notice.

borrowers and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) of section 13 of Act read with rule 8 & 9 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 11 thday of November of the year 2024. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with

The borrowers having failed to repay the amount, notice is hereby given to the

the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Kachhiawadi Branch, for an amount of Rs. 22,12,325.68/-+ un applied interest from 08/07/2024 + Legal & other exponses.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time evailable, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY Equitable Mortgage Property Bearing Municipal House No. 329, Located at Plot No. B/19 and B/20, plotted land admeasuring 87.82 Sqmt i.e. 945 sqft (Plot No B-19) + 87.82Sqmt i.e. 945 sqft (Plot No B-20) , total land area 175.65. sqmt. and construction admeasuring 125.42 sqmt i.e. 1350 sqft, which is situated at "Savan Nagar", Village Supa (Kurel), Tal and Dist. Navsari, Bearing Block No. 465/paikee 1/Paikee 2 (Old), 576 (New) and 465 /Paikee 1/Paikee 3 (Old), 579 (New), Khata No. 474, City Navsari, Dist. Navsari. Property in the name of Mr. Anshu Rajnarayan Das • Bounded by : • North : Contiguous Plot no B-21, . South: Contiguous open land, . East: Open Road of the said

land, • West : Contiguous plot No B-17 and B-18 **Authorised Officer**, Date : 11.11.2024 Place: Navsari **Bank of Baroda**



NANPURA Branch: UG-1,2,3, Tirupati Plaza, Opp, Family Court, Nanpura, Surat-395017

POSSESSION NOTICE

SCHEDULE 6, [Rule - 8(1)] (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the Union Bank of India, Nanpur Branch, Surat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act) 2002 (3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 09/09/2024 under section 13 (2) of the said act calling upon the Mr. Sagar Jayeshbhai Thummar (Borrower & Mortgagor), Mrs. Gitaben Jayeshbhai Thummar (Co-Borrower & Mortgagor), Mr. Girdharbhai Jerambhai Lakkad (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 20,39,911.28/- (Rupees Twenty Lakh Thirty-Nine Thousand Nine Hundred Eleven and Paise Twenty-Eight Only) as or 06.09.2024 with further interest thereon & expenses within 60 days from the date of receipt of the said notice.

The borrowers/mortgagor/guarantors having failed to repay the amount, Notice is hereby given to the borrowers and guarantors and public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 & 9 of the said rules on this 12th day of November of the year 2024.

The borrowers/mortgagor/guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India, Nanpura Branch, Surat for an amount of Rs. 20,39,911.28/- (Rupees Twenty Lakh Thirty-Nine Thousand Nine Hundred Eleven and Paise Twenty-Eight Only) as on 06.09.2024 with further interest thereon Plus other

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the

Act, in respect of time available, to redeem the secured assets. DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that part and parcel of the property consisting of Land and Building bearing Plot No. 21 admeasuring 83,84 sq. mtrs., with proportionate undivided inchoate share of Road and COP of Land in residential society known as "krushna Kunj Society" situated at R.S. No. 9 & 10, Block No. 12/B, Village: - Kamrej, Surat, Owned by Mr. Sagar jayeshbhai Thummar & Mrs. Gitaben Jayeshbhai Thummar

Date: 12.11.2024 Authorised Officer, Place : Surat Union Bank of India



NANPURA Branch: UG-1,2,3, Tirupati Plaza, Opp, Family Court, Nanpura, Surat-395017

POSSESSION NOTICE

SCHEDULE 6, [Rule - 8(1)]

Whereas, the undersigned being the Authorized Officer of the Union Bank of India, Nanpura Branch, Surat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act) 2002 (3 of 2002) and in exercise of powers conferred under section 13(2) read with rule 8 & 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 31/08/2024 under section 13 (2) of the said act calling upon the Mr. Pravinbhai Chandubhai Vasani (Borrower), Mrs. Manishaben Pravinbhai Vasani (Co-Borrower), Mrs. Rasilaben Rameshbhai Bhaliya (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 1,89,654.59/- (Rupees One Lakh Eighty-Nine Thousand Six Hundred Fifty-Four and Paise Fifty-Nine Only) as on 30.08.2024 with further interest thereon & expenses within 60 days from the date of receipt of the said notice.

The borrowers/mortgagor/guarantors having failed to repay the amount, Notice is hereby given to the borrowers and guarantors and public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 & 9 of the said rules on this 12th day of November of the year 2024.

The borrowers/mortgagor/guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India, Nanpura Branch, Surat for an amount of Rs. 1,89,654.59/- (Rupees One Lakh Eighty-Nine Thousand Six Hundred Fifty-Four and Paise Fifty-Nine Only) as on 30.08.2024 with further interest thereon Plus other Charges.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that piece and parcel of the immoveable property known as Plot no. 20 admeasuring area 63.59 sq. mts. along with common rights construction made or to be made on thereon and undivided proportionate share in the common roads and COP of "Shreeji (Mota Varachha) Co. Op. Housing Society Ltd" situated on the land bearing revenue survey no. 192 Block no. 198 T.P Scheme no. 24 (Mota Varachha Utran) F.P. no. 58 of village Mota Varachha Taluka Surat City District Surat - 394101.

Authorised Officer, Date: 12.11.2024 Place: Surat Union Bank of India

ISHAN DYES & CHEMICALS LIMITED

Tel.: 079-25832144/25893607, Fax: 079-25833643 E-mail: ishandyes@yahoo.com, Website: www.ishandyes.com CIN: L24110GJ1993PLC020737

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2024. All amount in Rs. Lacs unless otherwise stated Quarter | Quarter | Half Year | Half Year Particulars

Partito Contra	Ended 30-09-24	Ended 30-09-23	30-09-24	Ended 30-09-23
	Una	udited	Unac	udited
Total income from operations (net)	3150.99	2416.65	6521.35	3692.08
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	135.94	(6.08)	227.14	(178.88)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	135.94	(6.08)	227.14	(178.88)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	131.73	(31.90)	219.80	(209.23)
Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	131.73	(31.90)	219,80	(209.23)
Total Comprehensive Income for the period	131.73	(31.90)	219.80	(209.23)
Paid Equity share capital [Face Value Rs. 10/- Per Share]	2096.81	2096.81	2096.81	2096.81
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				8
Earnings per share (before extraordinary items) (of Rs.10/- each) (EPS for the quarters are not annualised): in Rs.				
(a) Basic	0:63	(0,15)	1.05	(1.00)
(b) Diluted	0.63	(0.15)	1.05	(1.00)
Earnings per share (after extraordinary items) (of Rs.10/- each) (EPS for the quarters are not annualised): in Rs.				
(a) Basic	0.63	(0.15)	1.05	(1.00)
(b) Diluted	0.63	(0.15)	1.05	(1.00)
Notes:				

The above is an extract of the detailed format of Un-Audited Standalone Financials Results of the Company for the Quarter and Half Year ended 30th September, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the websites of Stock Exchange at www.bseindia.com and also on Company's website www.ishandyes.com


Place: Ahmedabad

Date: 13th November, 2024

For and on behalf of the Board of Ishan Dyes & Chemicals Limited Shrinal P. Patel

Whole Time Director DIN: 02992519





SHUBHAM POLYSPIN LIMITED

(CIN: L17120GJ2012PLC069319)

Registered Office: Block No. 748, Saket Industrial Estate, Nr. Kaneria Oil Mill, Jetpura- Basantpura Road, Village: Borisana, Tal-Kadi Dist:-Mehsana-382728 (Gujarat) E-mail Id: ankit@shubhamqrp.co, Website: shubhampolyspin.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30™ SEPTEMBER 2024

UNAUDITED FINANCIAL RESULTS FUR TE	IL GUANTEN	LINDLD OIN	JU SEFIEIV	IDLN, 2024
				(Rs. in Lakhs)
PARTICULARS	Quarter ended on 30-09-2024 (Unaudited)	Quarter ended on 30-06-2024 (Unaudited)	Quarter ended on 30-09-2023 (Unaudited)	Year ended on 31-03-2024 (Audited)
Total income from operations	1498.97	1186.40	1453.25	4692.71
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	16.80	23.51	41.10	114.58
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	16.80	23.51	41.10	114.58
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	12.02	17.12	27.50	83.39
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	12.04	17.12	27.32	83.39
Equity Share Capital	1212.20	1212.20	1212.20	1212.20
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)		-	-	234.54
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	0.10	0.14	0.23	0.69

Note:-

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.
- The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the website of the Company. (www.shubhampolyspin.com).
- 3. #- Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

For, Shubham Polyspin Limited,

Date: 14th November, 2024 Place: Borisana

Ankit Anil Somani Managing Director (DIN: 05211800)

શાખા ઓફ્રિસ : આઈસીઆઈસીઆઈ બેંક લિમીટેડ, હેરીટેડ ચેમ્બર્સ, બીજો માળ, **શાખા આક્સ : આ**ગતાજાના ના કાર્યાસક, આગદાવાદ - ૩૮૦૦૧૫.

જાહેર સુચના - મુકરર મિલકતના વેચાણ માટે ટેન્ડર કમ ઈ-હરાજી નોટીસ

(ଜିଥ୍ୟ ୯(୨) ની જોગવાઇ જુઓ) स्थापर भिलङ्गतना पेचाए। भाटेनी स्चना

સિકયુરીટાઈઝેશન એન્ડ રીકન્ટ્રકશન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકત મિલકતોના વેચાણ માટેની આ ઈ-હેરાજી નોટીસ આઈસીઆઈસીઓઈ બેંક લિમીટેડ દ્રારા (દિવાન હાઉસીંગ ફાયનાન્સ લિમીટેડ (ડીએચએફએલ) દ્રારા આઈસીઆઈસીઆઈ બેંકને સોંપવામાં આવેલા અંર્તગંત પુલ પ્રમાણે) ડીએચએકએલ અને નીચેના દેવાદાર/ઓ, સહ -દેવાદાર/ઓ, બાંયધરી આપનાર/ઓ વચ્ચે થયેલા લોન કરાર અનુસંધાનમાં આપવામાં આવેલી હાઉસીંગ લોન સુવિધાના સંદર્ભમાં અને સુરક્ષાના અમલીકરણના સંબંધમાં સિકયોરીટી ઈન્ટરેન્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ - ૨૦૦૨ ના ૮(૬) ની જોગવાઈ સાથે જાહેર કરવામાં આવી છે.

આથી જાહેર જનતાને અને ખાસ કરીને દેવાદાર/ઓ, સહ -દેવાદાર/ઓ, જામીનદારોને નોટીસ ચેતવણી આપવામાં આવે છે મળેલ સત્તાની રૂએ આઈસીઆઈસીઆઈ બેંક લિમીટેડ ની બાકી માટે નીચે જણાવેલ સ્થાવર મિલકતનો અધિકૃત અધિકારી દ્રારા ભૌતિક કબજો લેવામાં આવેલ છે અને નીચે આપેલ સંક્ષિપ્ત વિગતો મુજબ જયાં છે, જેમ છે અને અને જે છે ના આધારે વેચવામાં આવશે.

ક્રમ નં.	નં. જામીનદારોનું નામ, મિલ્કતની વિગત લોન એકાઉન્ટ નંબર		બાકીની રકમ	अनाभत डिंभत જभा डराववानी બानानी रडभ	મિલ્કત નિરીક્ષણની તારીખ અને સમય	ઇ-હરરાજીની તારીખ અને સમય
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
۹.	કુલદીપ હરીભાઈ પટેલ (દેવાદાર) / હસુમતીબેન હરીભાઈ પટેલ (સહ-દેવાદાર) A/c No. QZMEH00005039329	ફલેટ નં. એ/૯, નવમો માળ, આશોપાલવ ફલેટ, હેપી હોમ સીએચએસએલ કામા હોટલ ની પાસે, સીટી સર્વે નં. ૪૧૦૦ થી ૪૧૦૬, ખાનપુર, શાહપુર વોર્ડ નં. ૨, અમદાવાદ-૩૮૦૦૦૧. ક્ષેત્રફળ એરીયા પ૮.પ૩ ચો.મીટર - ફ્રી હોલ્ડ પ્રોપર્ટી	રૂા. ૨૫,૫૬,૦૮૪/- (૦૪ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ)	રૂા. ૧૯,૫૦,૦૦૦/- રૂા. ૧,૯૫,૦૦૦/-	03, ડીસેમ્બર ૨૦૨૪ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૦૦ સુધી	૨૧, ડીસેમ્બર ૨૦૨૪ સવારે ૧૧:૦૦ થી
₹.	અરીહંત શંકરલાલ જૈન (દેવાદાર) / ઈન્દ્રદેવીબેન શંકરલાલ જૈન (સહ-દેવાદાર) A/c No. QZABD00005039461	યુનિટ નં. ૧૧૧, સિધ્ધી વિનાયક એવન્યુ, સર્વે નં. ૧૧૨૬/૧, ૧૧૨૮, ૧૧૨૯, ફાઈનલ પ્લોટ નં. ૪૬/૧/૧ + ૪૬/૧/૨, દી.પી. નં. ૮૭, બિમલ ફાર્મની સામે, એલ.એલ.એમ. રોડ, વટવા, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૦, ક્ષેત્રફળ એરીયા ૩૬.૩૪ ચો.મીટર - ફ્રી હોલ્ડ પ્રોપર્ટી	રૂા. ૧૩,૪७,૩૩૦/- (૦૪ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ)	३।. ९२,००,०००/- ३।. ९,२०,०००/-	o3, ડીસેમ્બર ૨૦૨૪ બપોરે ૧૨.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી	૨૧, ડીસેમ્બર ૨૦૨૪ સવારે ૧૧:૧૫ થી

હરરાજીની એજન્સી મેસર્સ નેકસજેન સોલ્યુસન્સ પ્રાઈવેટ લિમીટેડની વેબસાઈટ : (URL Link- https://disposalhub.com) પર આ ઓનલાઈન હરરાજી યોજવામાં આવશે. ગીરો મુકનારને તા. ૨૦.૧૨.૨૦૨૪ ના સાંજે ૪.૦૦ વાગ્યા સુધી બાકી રકમ તથા તેના પરનું વ્યાજ ભરી જવા માટે છેલ્લી તક છે જો તેમ નહી થાય તો ગીરો મિલકતના તેંના નકકી કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ વેચી દેવામાં આવશે.

ઈચ્છુક બીડરોએ ઉપરોક્ત જણાવેલ બાનાની રકમ જે કોલમ નં. (ઇ) માં જણાવેલ છે તે રકમ આઈસીઆઈસીઆઈ બેંક લિમીટેડ. હેરીટેજ ચેમ્બર્સ. બીજો માળ, આઝાદ સોસાયટી, ક્રોસ રોડની પાસે, નેહરુનગર, અમદાવાદ - ૩૮૦૦૧૫ ખાતે ૨૦.૧૨.૨૦૨૪ બપોરે ૩.૦૦ વાગ્યા પહેલા મળે તે રીતે જમા કરાવવી અને ત્યાં તેઓએ ઉપરોક્ત જણાવેલ વેબસાઈટ દ્રારા તેમની ઓકર તા. ૨૦.૧૨.૨૦૨૪ ના સાજે ૪.૦૦ વાગ્યા પહેલા રજૂ કરવાની રહેશે અને તેની સાથે બેંકે સ્વીકારેલ ડીડીની સાબિતી માટે બાનાની રકમના ફોટો કોપી અપલોડ કરવાની રહેશે જો ઈચ્છકુ બીડરો અનિવાર્ય કારણોસર તેમની ઓફર ઉપરોકત જણાવેલ વેબસાઈટ દ્રારા મોકલી ન શકે તો ટેન્ડર દસ્તાવેજની સહી કરેલી કોપી આઈસીઆઈસીઆઈ બેંક લિમીટેડ, હેરીટેજ ચેમ્બર્સ, બીજો માળ, આઝાદ સોસાયટી, ક્રોસ રોડની પાસે, નેહરુનગર, અમદાવાદ - ૩૮૦૦૧૫ ખાતે ત્યારે જ અથવા ૨૦.૧૨.૨૦૨૪ સાંજે ૦૫.૦૦ વાગ્યા પહેલા રજૂ કરવાની રહેશે ઈએમડી, ડીડી, પીઓ, નેશનલાઈઝ અથવા શિડયુલ બેંકનો આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ નામનો અને અમદાવાદ ખાતે ચુકવણી થાય તેવો હોવો જોઈએ.

નિરીક્ષણ, ઈ-હરાજીની શરતો અને નિયમો, ટેન્ડર્સ સુપ્રત કરવા, વિગેરે અંગેની વધારે સ્પષ્ટતા માટે આઈસીઆઈસીઆઈ બેંક કર્મચારીના ફોન નં. ૭૫૭૩૦૨૪૨૯૭ઉપર સંપર્ક કરવો.

આ સાથે નોંધ લેવી કે (૧). મેસર્સ નેકસજેન સોલ્યુસન્સ પ્રાઈવેટ લિમીટેડ, (૨). ઓજીયો એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમીટેડ માર્કેટીંગ એજન્સીઓ પણ આ સંપતીના વેચાણની સુવિધા માટે જોડાયેલ છે.

સત્તાવાર અધિકારીને કોઈપણ બીડ રદ કરવાનો કોઈપણ પ્રકારના કારણ આપ્યા વિના રદ કરવાનો અબાધિત અધિકાર છે.

વેચાણની શરતો અને નિયમોની વધારે માહિતી જોઈતી હોય તો આઈસીઆઈસીઆઈ બેંક લિમીટેડની વેબસાઈટ: www.icicibank.com/n4p4s પર

તારીખ : ૧૫.૧૧.૨૦૨૪ સ્થળ : અમદાવાદ

DATE: 14th November, 2024

PLACE: GANDHINAGAR

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈસી બેંક લિમીટેડ

UMIYA TUBES LIMITED

(CIN: L28112GJ2013PLC074916)

Registered Office: 208, 2nd Floor, Suman Tower, Sector No. - 11, Gandhinagar -382011(Gujarat) Website: www.umiyatubes.in E-Mail ID: info@umiyatubes.in UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2024

		•	(4	Amount in Lakhs)
Particulars	Quarter ended on 30-09-2024 (Unaudited)	Quarter ended on 30-06-2024 (Unaudited)	Quarter ended on 30-09-2023 (Unaudited)	Year ended on 31-03-2024 (Audited)
Total income from operations	21.11	135.08	9.12	53.41
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	(54.25)	(156.61)	(48.96)	(372.10)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	(54.25)	(156.61)	(48.96)	(372.10)
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	(54.25)	(156.61)	(48.62)	(339.65)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(82.63)	(188.16)	38.91	(217.91)
Equity Share Capital	1000.67	1000.67	1000.67	1000.67
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	-	182.64
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (a) Basic & (b) Diluted	(0.83)	(1.57)	(0.49)	(2.18)

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results are available on the Stock Exchange website

(www.bseindia.com) and on the website of the Company. (www.umiyatubes.in). 3. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules.

By Order of the Board. FOR, UMIYA TUBES LIMITED

SAURABHKUMAR R. PATEL **CHAIRPERSON & MANAGING DIRECTOR** (DIN NO. 06964670)

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે લક્ષ્ય એસઆઈપી લોન્ચ કરી

(એસઆઈપી) અને સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (એસડબ્લ્યુપી)નું

અમદાવાદ. બરોડા બીએનપી સ્કીમ્સ પૈકીની એક સ્કીમમાં માસિક પારિબા મ્યુચ્યુઅલ ફંડે લક્ષ્ય એસઆઈપી દ્વારા ૮. ૧૦. ૧૨ એસઆઈપી નામનું વેલ્થ-બિલ્ડિંગ અથવા ૧૫ વર્ષના ગાળા માટે પદ્ધતિસર અને રેગ્યુલર ઇક્રમ સોલ્યુશન રજૂ કર્યું બચત કરી શકે છે. આ સ્કીમ્સ લાંબા છે. આ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ગાળે સંપત્તિ સર્જન માટેની સંભાવના પૂરી પાડે તે પ્રમાણે કાળજીપૂર્વક તૈયાર પસંદ કરવામાં આવી છે. પસંદ કરેલા મિશ્રણ છે જે રોકાણકારોને તેમના એસઆઈપી સમયગાળાના અંતે ભેગા નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કરવા અને થયેલા રોકાણકારની પસંદગી મુજબ તેમને નિયમિત માસિક આવક બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ મેળવવામાં મદદ કરવા માટે તૈયાર ફંડની પાંચ હાઇબ્રિડ સ્ક્રીમ્સ પૈકીની કરવામાં આવ્યું છે. લક્ષ્ય એકમાં સ્વિચ કરવામાં આવે છે ત્યારબાદ એસઆઈપીથી રોકાણકારો બરોડા પહેલેથી નક્કી એવો સિસ્ટમેટિક વિડ્રોઅલ બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ પ્લાન શરૂ થાય છે જે નિયમિત માસિક દ્વારા ઓફર કરાતી ઇક્વિટી-સંબંધિત આવક પૂરી પાડે છે.

ધી ધ્રુવ પટેલ શો



અમદાવાદ, આપના સવિશેષો માટે એક વિશિષ્ટ મંચ – ધી ધ્રવ પટેલ શો, જલ્દી જ શરૂ થવા જઈ રહ્યો છે! જાણીતા ગુજરાતી અભિનેતા અને નિર્દેશક ધ્રવ પટેલ દ્વારા સંચાલિત આ

ધ્રુવ પટેલ, એક્ટિંગ શિક્ષક તરીકે જાણીતા છે અને ૨૦૦૭માં તેમણે પોતાની પહેલી ફિલ્મ સ્નેહના સગપણથી અભિનયની શરૂઆત કરી હતી, જે તે સમયે સુપરહિટ રહી. શોમાં વિવિધ ક્ષેત્રોના મોટા મહેમાનો તેમણે હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મો સાથેની અનોખી મુલાકાતો અને માં કામ કર્યું છે તેમણે અવીરા અને મજેદાર વાતો દર્શકોને મનોરંજન ફરાક જેવી અનેક એવોર્ડ વિજેતા અને પ્રેરણા આપશે. ગાંધીનગર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે, જે આજે નિવાસી અને ગુજરાતી ફિલ્મ પણ લોકોને પ્રભાવિત કરે છે. ઇન્ડસ્ટ્રીના અનુભવી કલાકાર તરીકે ૨૦૧૦ માં ઈન્ટરનેશનલ કલ્ચરલ ધ્રુવે ફિલ્મોમાં બહુજ કામ કર્યું છે અને એક્ટિવિટી માટે ઇન્ડિયન એમ્બેસેડર તેમની પ્રતિભા અને અભિનયનો તરીકે તેમણે એક વર્ષ જર્મની વિતાવ્યું અનુભવ આ શોને વિશિષ્ટ બનાવશે. હતું.

CERA સેનિટરીવેર લિ.એ અમદાવાદમાં CERA સ્ટાઇલ સ્ટ્રુડિયોને ફરીથી ખોલવાની જાહેરાત કરી



એક્રોપોલિસ મોલમાં તેના નવા એલિવેટેડ ડિસ્પ્લે અનુભવ પ્રદાન પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

અમદાવાદ, CERA, બાથ3મ કરવા માટે CERA ની પ્રતિબદ્ધતાને સોલ્યુશન્સનું પ્રીમિયમ પ્રદાતા, પ્રકાશિત કરે છે. શ્રી વિક્રમ સોમાણી તાજેતરમાં થલતેજ, અમદાવાદમાં દ્વારા ટાંકવામાં આવ્યા મુજબ "અમદાવાદમાં નવા સધારેલા રિનોવેટેડ CERA સ્ટાઇલ સ્ટ્રુડિયો ઝઈઇછ સ્ટાઈલ સ્ટ્રુડિયોના ભવ્ય પુનઃ (કંપનીની માલિકીનું ડિસ્પ્લે સેન્ટર) ઉદઘાટનની જાહેરાત કરતાં અમે નું અનાવરણ કર્યું. ઉદ્ઘાટનનું નેતૃત્વ રોમાં ચિત છીએ. આર્કિટેક્ટ્સ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડેવલપર્સ અને ગ્રાહકો માટે વિશિષ્ટ વિક્રમ સોમાની સાથે જોઈન્ટ મેનેજિંગ રીતે ડિઝાઇન કરાયેલ, આ નવો ડિરેક્ટર શ્રીમતી દીપશિખા ખેતાન ૩૫ાંતરિત શો ૩મ અમારી મખ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોડક્ટ કેટેગરીઝઃ સેનિટરીવેર, ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સ, ફૉસેટ્સ અને ટાઇલ્સમાં શ્રેષ્ઠતા, ડેવલપર્સ અને ચેનલ પાર્ટનર્સે હાજરી નવીનતા અને ઉચ્ચ ગણવત્તાના આપી હતી. જે તેના ગ્રાહકો માટે ધોરણો પ્રત્યેની અમારી અતટ

ઈશાન ડાયસ એન્ડ કેમિકલ્સ લિમીટેડ **રજીસ્ટર્ડ ઓફિસ**ઃ પ્લોટ નં. ૧૮, જીઆઈડીસી એસ્ટેટ, ફેઝ - ૨, વટવા, અમદાવાદ. **ઢેલિ.** ૦૭૯-૨૫૮૩૨૧૪૪ / ૨૫૮૯૩૬૦૭, ફેક્સઃ ૦૭૯ - ૨૫૮૩૩૬૪૩.

E-mail: ishandyes@yahoo.com; Website: www.ishandyes.com CIN: L24110GJ1993PLC020737 30भी सप्टेम्पर, २०२४ जा रोष पूरा थयेला डवार्टर अने अर्ध वर्ष भाटे अनओडीटेड स्टेन्डअलोन नाष्टांडीय परिष्टामोना निवेदननो अर्ड



	तभाभ रङ्भ	રૂા. લાખો જયાં	મો જયાં સુધી અન્યથા જણાવેલ હોય						
વિગતો	કવાર્ટર સમાપ્ત 30.06.૨૦૨૪	સમાપ્ત 30.06.૨૦૨૩	અર્ધ વર્ષ પૂર્ણ ૩૦.૦૯.૨૦૨૪	અર્ધ વર્ષ પૂર્ણ 30.06.૨0૨3					
ra-mi		ોડીટેડ)	(અનઅ						
કામકાજમાંથી કુલ આવક (ચોખ્ખી)	3150.99	2416.65	6521.35	3692.08					
ગાળાનો ચોખ્ખો નફો/તોટો (વેરા, અપવાદરૂપ અને / અથવા અસાધારણ ચીજો પહેલા	135.94	(6.08)	227.14	(178.88)					
વેરા પુર્વે ગાળાનો ચોખ્ખો નફો/તોટો (અપવાદરૂપ ચીજો અને અસાદારણ ચીજો પછી)	135.94	(6.08)	227.14	(178.88)					
વેરા પુર્વે ગાળાનો ચોખ્ખો નફો / તોટો (અપવાદરૂપ ચીજો અને અસાધારણ ચીજો પછી)	131.73	(31.90)	219.80	(209.23)					
ગાળાની કુલ સંયુક્ત આવક (ગાળાના નફો/(તોટા) (વેરા પછી) અને અન્ય સંયુક્તઆવક (વેરા પછી)(સહીત)	131.73	(31.90)	219.80	(209.23)					
સમયગાળા માટે કુલ વ્યાપક આવક	131.73	(31.90)	219.80	(209.23)					
ઇક્વિટી શેર કેપિટલ (મુળ કિંમત પ્રતિદીઠ રૂા. ૧૦/- ની)	2096.81	2096.81	2096.81	2096.81					
અનામતો (પુર્ન મુલ્યાંકિત અનામતો સિવાયની) પાછલા વર્ષના ઓડીટેડ સસ્વૈયામાં દર્શાવ્યા મુજબ		-	-						
શેર દીઠ આવક (અસાધારણ વસ્તુઓ પહેલાં) (પ્રતિદિઠ રૂા. ૧૦ ની) (કવાર્ટર માટે EPS વાર્ષિક નથી)									
(એ). બેઝીક	0.63	(0.15)	1.05	(1.00)					
(બી). ડાચલ્યુટેડ	0.63	(0.15)	1.05	(1.00)					
શેર દીઠ આવક (અસાધારણ વસ્તુઓ પછી) (પ્રતિદિઠ રૂા. ૧૦ ની) (કવાર્ટર માટે EPS વાર્ષિક નથી)									
(એ). ශින ි ප	0.63	(0.15)	1.05	(1.00)					
બી). કાચલ્યુ ટેક	0.63	(0.15)	1.05	(1.00)					
નોંધ :-									

૧. ઉપરના પરિણામો, સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ અને અન્ય ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરાયેલ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ પુરા થતાં ક્વાર્ટ અને અર્ધ વર્ષ સમાપ્તના અન-ઓડિટેડ નાણાંકીય પરિણામોની વિગતવાર માહિતીનો સાર છે. નાણાંકીય પરિણામોનું સંપૂર્ણ ફોર્મેટ સ્ટોક એક્સચેન્જ ની વેબસાઈટ

www.bseindia.com પર અને કંપનીની વેબસાઈટ : www.ishandyes.com પર પણ ઉપલબ્ધ ઈશાન ડાયસ એન્ડ કેમિકલ્સ લિમીટેડ

SIDISHHE : UIS તારીખ : ૧૩.૧૧.૨૦૨૪

શ્રીતાલ પી. પટેલ વોલ-ટાઈમ ડાયરેક્ટર,

DISHA RESOURCES LIMITED

Regd. Office: 3, Rajesh Apartment, B/h. Ajanta Comm. Estate, Ashram Road, Ahmedabad - 380014, Phone: (OFF). 2754-0790, 27543060, E-mail: disharesourceslimited@gmail.com CIN: L74110GJ1995PLC024869, Website: www.disharesourcesltd.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED AS ON 30th SEPTEMBER, 2024.

					(in Lakhs)
	Quarter Ender	1	Six Mont	ths Ended	Year Ended
30-Sept-24 Unaudited	30-June-24 Unaudited	30-Sept-23 Unaudited	30-Sept-24 Unaudited	30-Sept-23 Unaudited	31-Mar-24 Audited
3.25 0.12	1.18	140.74 1.17	3.25 1.30	140.74 276.43	140.74 318.42
3.37	1.18	141.91	4.55	417.17	459.16
(21.71)	(8.19)	(2.57)	(29.90)	263.17	292.36
(21.71)	(8.19)	(2.57)	(29.90)	263.17	292.36
(21.19)	(5.79)	(2.29)	(26.98)	233.88	302.44
7.11	299.54	539.26	306.65	779.39	311.84
731.55	731.55	731.55	731.55	731.55	731.55
3395.67	3388.57	3551.51	3395.67	3551.51	3089.02
0.11 0.11	4.08 4.08	7.37 7.37	4.19 4.19	10.65 10.65	4.25 4.25
	30-Sept-24 Unaudited 3.25 0.12 3.37 (21.71) (21.71) (21.19) 7.11 731.55 3395.67	30-Sept-24 30-June-24 Unaudited 3.25 - 1.18 3.37 1.18 (21.71) (8.19) (21.71) (8.19) (21.19) (5.79) 7.11 299.54 731.55 731.55 3395.67 3388.57	Unaudited Unaudited Unaudited 3.25 0.12 - 1.18 140.74 1.17 3.37 1.18 141.91 (21.71) (8.19) (2.57) (21.71) (8.19) (2.57) (21.19) (5.79) (2.29) 7.11 299.54 539.26 731.55 731.55 731.55 3395.67 3388.57 3551.51 0.11 4.08 7.37	30-Sept-24 Unaudited Un	30-Sept-24 Unaudited Un

- The above is an extract of the detailed format of quarter and three months ended unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the unaudited Financial Results is available on the stock Exchange website -www.bseinida.com & on company's website -www.disharesourcesltd.com
- The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th November, 2024.

The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the Quarter ended on 30th September, 2024 in accordance with IND-AS and other accounting principles generally accepted in India

For Disha Resources Limited Krishna Awtar Kabra **Managing Director** DIN: 00650817

Date: 14.11.2024 Place: Ahmedabad

સાંકેતિક કબ્જા નોટીસ

શાખાનું સરનામું : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં.૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ **(ગાંડાટા Bank)** નં.બી૩, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ) -૪૦૦૬૦૪.

આથી સિક્યુરીટાઇઝેશન રિકંસ્ટ્રક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના કાયદા ૧૩(૧૨) હેઠળ અને સિક્યોરિટી એક્ટ (એનફોર્સમેન્ટ)રૂલ્સ, ૨૦૦૨ના રૂલ ૩ સાથે વાંચતા આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ દ્વારા નીચે જણાવેલા દેવાદરોને માંગણા નોટિસ આપવામાં આવી હતી.(દિવાન હાર્લસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંને સોંપેલ પુલ અંતર્ગત)એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટીના અમલીકરણના સંબંધમાં, મંજૂર કરેલ હાઉસિંગ લોનની સુવિધાના સંદર્ભમાં દેવાદારો અને ડીએચએફએલની વચ્ચે થયેલા લોન કરાર અનુસાર દેવાદારો ને નોટિસમાં જણાવેલી રકેમ નોટિસ મલ્યાના ૬૦ દિવસની અંદર પરત કરવા અંગે જાણ કરવામાં આવે છે.

દેવાદારો બાકી લેણાં રકમ પરત કરવામાં નિષ્ફળ ગયા છે. આથી જાહેર જનતા અને દેવાદારોને સચિત કરવામાં આવે છે કે સેક્શન ૧ ૩(૪) અને ઉપરોક્ત રૂલ્સના રૂલ ૮ હેઠળ મલતાં અધિકારોની રૂએ નીચે જણાવેલી મિલકતોનો નીચે જણાવેલી તારીખે સોંકેતિક કબ્જો લઈ લેવામાં આવેલ છે. આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ પાસે મિલકતો ટાંચમાં હોઈ જાહેર જનતાને અને દેવાદારોને નીચે જણાવેલી મિલકતો સાથે કોઈ પણ જાતનો સોદો ન કરવા માટે તાકિદ કરવામાં આવે છે.

ક્રમ ન	દેવાદારોનું નામ / લોનનો ખાતા નંબર (ડીએચએકએલ જુના લેન અને આઈસીઆઈસીઆઈ નવા લેન)	મિલકતોની વિગતો / સાંકેતિક કબ્જાની તારીખ	િંકમાન્ડ નોટીસની તારીખ / ડિમાન્ડ નોટીસમાંની ૨કમ (રૂા)	શાખાનું નામ
ι	છાંટબાર (જુના ડીએચએફએલ લેન નં.	ફ્લેટ નં.સી-૪૦૪, ચોથો માળ, સી-વિંગ, શ્રી શંખેશ્વર-૩, શાંતિનગર-૨, પટેલ ચોક પાછળ, આરએસ.નં.૨૮પૈકી ૪, પ્લોટ નં.૧ થી ૨૪, નાની વિદી, નાગેશ્વર, જામનગર રોડ, ઘંટેશ્વર, રાજકોટ- ૩૬૦૦૦૬ /નવેમ્બર ૧૨, ૨૦૨૪	જુન ૨૯, ૨૦૨૪ રૂા ૭,૮૧,૨૦૧.૦૦/-	રાજકોટ

ઉપર જણાવેલા કરજદાર(રો)/જામીનદાર(રો)અહી બાકી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવેલ છે. જો નાણાં પરત કરવામાં નહીં આવે તો સિક્યરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ- ૨૦૦૨ની કલમ ૮ અને ૯ નીજોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કતો આ નોટીસ પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે. તારીખ: નવેમ્બર ૧૫, ૨૦૨૪ અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ સ્થળ : રાજકોટ

PUROHIT CONSTRUCTION LIMITED

CIN: L45200GJ1991PLC015878
REGD.OFFICE:401,PUROHIT HOUSE,OPP:STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009
Telephone Number- 079-26426486, Emai Id: cs@purohitconstruction.com
Website:www.purohitconstruction.com

Statement of Standalone unaudited Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2024

					(RS. III	Lakn except EPS)	
		Three Mon	iths ended	Half Yea	Year ended		
SI. No.	Particulars	30/09/2024	30/09/2023	30/09/2024	30/09/2023	31/03/2024	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1.	Total Income from Operations	0.00	0.00	0.00	0.00	0.09	
	Net Profit / (Loss) for the period (before Tax,						
2.	Exceptional and/or Extraordinary items#)	-8.78	-9.07	-17.85	-24.41	-43.99	
	Net Profit / (Loss) for the period before tax						
3.	(after Exceptional and/or Extraordinary items#)	-8.78	-9.07	-17.85	-24.41	-43.99	
	Net Profit / (Loss) for the period after tax (after						
4.	Exceptional and/or Extraordinary items#)	-9.00	-1.45	-16.61	-26.27	-46.24	
	[Comprising Profit / (Loss) for the period (after						
5.	tax) and Other Comprehensive Income (after	-9.00	-1.45	-16.61	-26.27	-46.52	
	Equity Share Capital (Equity Shares of Rs. 10/-						
6.	Each)	440.56	440.56	440.56	440.56	440.56	
	Reserves (excluding Revaluation Reserve) as						
	shown in the Audited Balance Sheet of the						
7.	previous year		-		-	0.00	
	Earnings Per Share (Face Value of Rs. 10/- each)						
8	(for continuing and discontinued operations) -						
	1. Basic:	-0.20	-0.17	-0.38	-0.60	-1.06	
	2. Diluted:	-0.20	-0.17	-0.38	-0.60	-1.06	

- of the Second Se

For and on behalf of the Board of Director NARENDRA M. PUROHIT



REGD. OFFICE: 403, Mauryansh Elanza, Nr. Parekh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad - 380 015. el. : (079) 2676 8572, 2676 8573 Fax : + 91 - 79 - 2676 857, CIN: 667120GJ1994PLC023803, E-Mail: ksbspl@yahoo.in, Web Site: www.kcsl.co.in EXTRACT STANDALONE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON

PARTICULARS		QUARTER ENDED			HALF YEAR ENDED	
		30/06/2024	30/09/2023	30/09/2024	30/09/2023	31/03/2024
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
MONTH COVERED	3	3	3	6	6	12
Total Income From Operating Income	18.37	8.63	10.11	27.00	18.70	39.30
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	1.97	(2.49)	4.67	(0.52)	5.98	16.39
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	1.97	(2.49)	4.67	(0.52)	5.98	16.39
Net Profit/(Loss) for the Period After Tax	1.48	(2.49)	3.51	(0.52)	4.49	13.83
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (After Tax)	1.48	(2.49)	3.51	(0.52)	4.49	13.83
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.05	(0.08)	0.11	(0.02)	0.14	0.44
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item		(0.08)	0.11	(0.02)	0.14	0.44

EXTRACT CONSOLIDATED STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON **SEPTEMBER 30, 2024**

(Amount in Baking)								
	QUARTER ENDED			HALF YEAR ENDED		YEAR ENDED		
PARTICULARS		30/06/2024	30/09/2023	30/09/2024	30/09/2023	31/03/2024		
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)		
MONTH COVERED	3	3	3	6	6	12		
Total Income From Operating Income	18.37	8.63	10.11	27.00	18.70	39.30		
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	1.97	(2.49)	4.67	(0.52)	5.98	16.39		
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	(0.09)	(5.41)	2.64	(5.50)	3.80	17.67		
Net Profit/(Loss) for the Period After Tax	(0.09)	(5.41)	1.98	(5.50)	2.85	14.91		
Total Comprehensives Income For the Period (Comprehensing Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (After Tax)		(5.41)	1.98	(5.50)	2.85	14.91		
							Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item		(0.17)	0.06	(0.17)	0.09	0.47		
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item		(0.17)	0.06	(0.17)	0.09	0.47		

- I The above Unaudited Standalone & Consolidated Financial Results of the Company for the Quarter and Half Year Ended September 30, 2024 have beer prepared in accordance with the recognition and measurement principles laid down in applicable Indian Accounting Standards ("Ind AS") as prescribed der section 133 of the Companies Act. 2013. as amended, read with relevant rules thereunder and in terms of regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. These Unaudited Standalone & Consolidated Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 14, 2024. The statutory auditors have expresse an unmodified audit opinion on the standalone financial results.
- ! In compliance with Ministry of Corporate Affairs notification w.r.t. to amendment in Schedule III to the Companies Act, 2013 effective from April 01, 2021 figures of comparative previous periods have been regrouped/reclassified wherever necessary.

3 The Figure of the Previous Period has been Regrouped or Reclassified, wherever necessary

BY ORDER OF THE BOARD KRISHNA CAPITAL & SECURITIES LIMITE

OKKUM AR BARULAL AGRAWAL